

ત્વરિત જાહેરાત માટે

યુનાઈટેડ વે માટે ભંડોળ ઊભું કરવા
સિટી ઓફ બ્રેમ્પટન લોંગેસ્ટ નાઈટમાં ભાગ લેશે



મેયર પેટ્રિક બ્રાઉન, કાઉન્સિલર ફોર્ટિની અને કાઉન્સિલર સિંઘ લોંગેસ્ટ નાઈટમાં ભાગ લેતા પહેલા બ્રેમ્પટનની ટીમને શુભેચ્છા પાઠવતા હોવાનું દ્રશ્ય.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 ફેબ્રુઆરી 2022) – ગત રાત્રે, સિટી ઓફ બ્રેમ્પટને લોંગેસ્ટ નાઈટમાં ભાગ લીધો હતો જે એવો વાર્ષિક પ્રસંગ છે

જ્યારે વ્યક્તિઓ અને પરિવારોને એક રાત પોતાની કારમાં વિતાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી ગરીબીમાં જીવતા બાળકો અને વયસ્કો જે પડકારોનો સામનો કરે છે તે અંગે જાગૃક્તા ફેલાવી શકાય. સંસ્થામાંથી ટીમના સભ્યો સહિત દસ વ્યક્તિઓ અને તેમના પરિવારોએ આ અનુગ્રહી અનુભવ લઈને બહાદુરીથી કુદરતી તત્વોનો સામનો કર્યો.

આ પહેલના ટેકામાં સીટી ઓફ બ્રેમ્પટનના સ્ટાફ ને સહયોગીઓએ \$5,000 કરતા વધુ રકમ ઊભી કરી જે સિટીના વાર્ષિક યુનાઈટેડ વે ભંડોળ અભિયાનને પ્રદાન થશે. સિટી ઓફ બ્રેમ્પટન યુનાઈટેડ વેને 40 કરતા વધુ વર્ષોથી ટેકો આપી રહ્યા છે અને તેઓ તે સમયમાં આશરે \$2.5 મિલિયનનું ભંડોળ ઊભું કરવામાં સફળ રહ્યા છે જે સીધું સમુદાયના વિકાસ માટે વપરાય છે.

સુવાક્યો

આપણા સમુદાયમાં ઘણા લોકો માટે જે નગન વાસ્તવિકતા છે એવી ગરીબી અને ઘરવિહોળા હોવા વિશે જાગૃક્તા લાવવા માટે લોંગેસ્ટ નાઈટમાં ભાગ લેવા અને આ પડકાર ઝીલવા માટે આગળ આવ્યા છે તેવા ટીમના સભ્યો માટે મને અત્યંત ગર્વની લાગણી થાય છે. દર વર્ષે મૂલ્યવાન ભંડોળ ઊભું કરવા અમને યુનાઈટેડ વે સાથે સહયોગ સાધવાનું અમને ગૌરવ છે જે સીધું એવા લોકોને મદદરૂપ થવા પહોંચે છે જેઓને સૌથી વધુ જરૂર છે. યુનાઈટેડ વેનો અમે આભાર માનીએ છીએ કે તેઓ બ્રેમ્પટન માટે આવા મૂલ્યવાન સંસાધન બન્યા.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

2022 માં સતત ચોથા વર્ષે યુનાઈટેડ વે કમિટી કાઉન્સિલના પ્રાયોજક બનવું એ સન્માનની વાત છે અને તે પણ એવી ટીમ સાથે કાર્ય કરવું જેઓ આપણા સમુદાય માટે ઈવેન્ટ્સ યોજવા અને ભંડોળ ઊભું કરવા આકાશ પાતાળ એક કરે છે. મને એ જોઈને ખૂબ ગર્વ છે કે અમે લોંગેસ્ટ નાઈટ પહેલ વડે અમારું ભંડોળ ઊભું કરવાના લક્ષ્યને પાર કરી લીધું છે. અમારી વાર્ષિક ભંડોળ એકત્રીકરણ ઝુંબેશને શરૂ કરવાની આ કેવી સરસ રીત છે."

- ડુગ વિહલાન્સ, યુનાઈટેડ વે કાઉન્સિલ પ્રાયોજક, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6

"લોંગેસ્ટ નાઈટમાં ભાગ લેવો તે ખરેખર વિનમ્રતાની ક્વાયત હતી જેમાંથી તે વાસ્તવિકતાની ઝલક મળે છે કે આપણા સમુદાયમાંથી લોકોએ રોજ રાતે કેવી બાબતોનો સામનો કરવો પડે છે. મને આ વર્ષે સિટી ઓફ બ્રેમ્પટન યુનાઈટેડ વે કમિટી પ્રમુખ બનવા બદલ અને અમારા સમુદાયને ટેકો આપવા માટે અથાક મહેનત કરતા સ્વયંસેવકોની જુસ્સાદાર ટીમ સાથે કાર્ય કરવા બદલ મને ગર્વ છે."

- સ્ટિવ ગાણેશ, 2022 યુનાઈટેડ વે સમિતિ પ્રમુખ, મેનેજર, ડેવેલપમેન્ટ સર્વિસિસ

"મારે સીટી ઓફ બ્રેમ્પટનનો સહય આભાર માનવો છે કે તેમણે ભંડોળ તો ઊભું કર્યું જ પણ સાથે તેમના લોંગેસ્ટ નાઈટના ઉત્કૃષ્ટ અને ચાલુ રાખેલા સમર્થનથી ઘર વિહોળા હોવા અંગેની જાગૃક્તા ઊભી કરી. પીલ રિજનમાં એવા 10,800 કરતા વધુ લોકો છે જેઓ ઘર વિહોળા છે

અથવા જેઓ બેઘર થવાના જોખમનો સામનો કરી રહ્યા છે. યુનાઈટેડ વે સિટી ઓફ બ્રમ્પટન સાથે સહયોગ કરતા રહેવા પ્રતિબદ્ધ છે જેમકે એની સામુદાયિક સંસ્થાઓ જેથી સમુદાયને સહાય કરી શકાય અને પીલમાંથી ગરીબી દૂર કરી શકાય.

- ડેનિએલ ઝાનોટી, પ્રમુખ અને CEO, યુનાઈટેડ વે ગ્રેટર ટોરોન્ટો

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca